

નવીન રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (NCF) અંતર્ગત જિલ્લા કક્ષાની DLC બેઠક

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત નવીન રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા (NCF) ની રચના થઈ જઈ રહી છે. નવીન રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખાની રચના થાય તે પહેલા રાજ્ય કક્ષાની અભ્યાસક્રમ રૂપરેખા તૈયાર થાય તે મહત્વનું છે. રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા (SCF) ની રચનામાં સમગ્ર રાજ્યના શિક્ષણવિદો, અધિકારીશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ, વ્યવસાયકારો, શિક્ષણ સાથે સંકળાયેલી કોઇપણ વ્યક્તિઓના મંતવ્યો કે પ્રતિભાવોની સામેલગીરી કરી શકાય તે માટે જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં જિલ્લા પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ ખાતે તા. ૩૧/૧૨/૨૦૨૧ ના રોજ બેઠક યોજવામાં આવી.

જિલ્લા પરામર્શ બેઠકની શરૂઆતમાં પ્રાર્થના સભા બાદ કાર્યક્રમની રૂપરેખા અને પૂર્વભૂમિકા ડૉ. દશરથ ઓઝાએ આપી. ડાયટ પાટણના પ્રાચાર્યશ્રી ડૉ. પીન્કીબેન રાવલ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દ્વારા શિક્ષણમાં આવનાર બદલાવ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિના રાજ્યકક્ષાની ટાસ્ક ફોર્સના સભ્યશ્રી અને નાયતા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ ડૉ.અશોકભાઈ ઠક્કર દ્વારા વિશેષ આ બાબત પર છણાવટ કરવામાં આવી. અભિનય હાઇસ્કૂલ, સિધ્ધપુરના શિક્ષકશ્રી અને ટાસ્ક ફોર્સના સભ્યશ્રી રૂપેશભાઈ ભાટિયા દ્વારા પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું. C.B.S.E સાથે સંલગ્ન ભગવતી ઇન્ટરનેશનલ હાઇસ્કૂલ ચિરાગભાઈ પટેલ દ્વારા પણ પ્રસ્તુત રાષ્ટ્રીય શિક્ષણ નીતિની કેટલાક પાયાની બાબતો અને વાસ્તવિક અમલીકરણ થતા મળેલ પરિણામો અને પડતી મુશ્કેલીઓ બાબતે ચર્ચા કરવામાં આવી. આમ, શરૂઆતના બે કલાકના સેશનમાં સમગ્રતયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ચર્ચા આવરી લેવામાં આવી.

આ પરામર્શ બેઠકમાં School Education, Early Childhood Care and Education, Teacher Education, Adult Education જેવા વિવિધ ગ્રૂપમાં તજજ્ઞો સાથે ચર્ચા હાથ ધરવામાં આવી. દરેક વિભાગમાં મેમ્બર તરીકે ડાયટના અધ્યાપકશ્રીઓ ડૉ. દશરથ ઓઝા, ડૉ. મહેશ સોલંકી, ડૉ.પિનલબેન ગોરડિયા, ડૉ.ઝંખનાબેન ભટ્ટી, ડૉ. કિરણબેન મોદીએ

કાર્ય કર્યું તેમજ ડોક્યુમેન્ટ વધુ અસરકારક અને સંપૂર્ણ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા. સમગ્ર કાર્યક્રમનું સંકલન ડૉ. દશરથ ઓઝાએ કર્યું.

જિલ્લા પરામર્શ બેઠક (DLC) માં School Education ગ્રુપમાં ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી ઉપસ્થિત શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, NEP રાજ્ય કોર કમિટીના સભ્યશ્રીઓ, સ્ટેટ રિસોર્ટ ગ્રુપના સભ્યો, ટેકનોસેવી શિક્ષકો, વિજ્ઞાન ગણિત અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકશ્રીઓ, SMC ના સભ્યો દ્વારા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. દરેક DOCUMENTS માં સામેલ પ્રશ્નોની ચર્ચા કરી દરેક DOCUMENTS ને આખરી ઓપ આપવામાં આવ્યો. Early Childhood Care and Education ગ્રુપમાં બાળ વિકાસ કાર્યક્રમ કચેરીના અધિકારીશ્રીઓ, આંગણવાડીના કાર્યકર્તા બહેનો, સુપરવાઇઝરશ્રીઓ, પ્રજ્ઞા વર્ગમાં કાર્ય કરતા શિક્ષકશ્રીઓ બીઆરપી મિત્રો અને આંગણવાડી અભ્યાસક્રમના મોડ્યુલ લેખન માં જોડાયેલા મિત્રો સાથે ECCE ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. Teacher Education ગ્રુપમાં જિલ્લાની શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓમાં કાર્ય કરતા અધ્યાપકશ્રીઓ (જેમાં બી.એડ., એમ.એડ. કોલેજના પ્રિન્સિપાલશ્રીઓ, ડી.એલ.એડ કોલેજના અધ્યાપકશ્રીઓ, બી.એડ.ના તાલીમાર્થીઓ તેમજ તજજ્ઞ શિક્ષકશ્રીઓ દ્વારા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. Adult Education ગ્રુપમાં નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારીશ્રી Adult Education માં તજજ્ઞતા ધરાવતા શિક્ષકો, બી.આર.સી કોઓર્ડિનેટરશ્રી, પ્રૌઢ શિક્ષણમાં કાર્ય કરતી અન્ય સંસ્થાઓના કર્મચારી દ્વારા Adult Education ના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.

આમ, દરેક ગ્રુપમાં કો-ઓર્ડિનેટર અને ઉપસ્થિત સભ્યશ્રીઓ દ્વારા દરેક પ્રશ્નોની વિગતવાર ચર્ચા ધરાઈ અને જેની નોંધ રિપોર્ટર દ્વારા કરવામાં આવી. ગુજરાતી ભાષામાં નોંધાયેલ પ્રતિચાર અંગ્રેજીમાં રૂપાંતર કરવામાં આવ્યા. ત્યારબાદ ટેકનિકલ પર્સન દ્વારા તેનું કમ્પ્યુટરરાઈઝેશન કરવામાં આવ્યું. દરેક વિભાગમાં શિક્ષકો દ્વારા ફીલ્ડમાં થયેલ BEST PRACTICES ની નોંધ પણ કરવામાં આવી.

જિલ્લા પરામર્શ બેઠકમાં ચાર ગ્રુપ માં થયેલ રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા બાબતના પ્રશ્નોની ચર્ચા દરમિયાન મળેલ પ્રતિભાવો જી.સી.ઈ.આર.ટી ને મોકલવામાં આવશે અને તેને NCF TECH PLATFORM પણ અપલોડ કરવામાં આવશે. જે NCF ની રચનામાં ઇનપુટ આપવા

માટે મહત્વના સાબિત થશે. છેલ્લે SCF અંતર્ગત જિલ્લા કક્ષાની પરામર્શ બેઠકમાં સામેલ તમામ પ્રતિભાગીઓનો જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

